

**B.Ed. Semester - 3 (CBCS) Examination**  
**Oct/Nov. -2019 (OLD COURSE)**  
**ELEMENTS OF ACCOUNT(ELECTIVE 1)**

Time: 1:15 Hours

Marks: 35

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- 
- પ્ર. ૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો. 08
- ૧.૧ ભાગીદારી એટલે શું?
  - ૧.૨ પાકું સરવૈયું ખાતું છે?
  - ૧.૩ પાઘડી એટલે શું?
  - ૧.૪ પેઢીના વિસર્જનની રીતો જણાવો.
- પ્ર.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૪ પ્રશ્નોના ઉત્તર આપો. (૫માંથી૪) ૧૨
- ૨.૧ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ જણાવો.
  - ૨.૨ ભાગીદારીના લક્ષણો જણાવો..
  - ૨.૩ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત જણાવો.
  - ૨.૪ ભાગીદારીમાં ફેરફારના કારણો જણાવો.
  - ૨.૫ ભાગીદારના નિવૃત્તિના સંજોગો જણાવો..
- પ્ર.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૩ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. (૫માંથી૩) ૧૫
- ૩.૧ સ્થિર મૂડી ખાતા અને અસ્થિર મૂડી ખાતા વચ્ચે તફાવત આપે.
  - ૩.૨ વેપારખાતું નમુના સાથે સમજાવો..
  - ૩.૩ પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? નમુનો આપી સ્પષ્ટ કરો.
  - ૩.૪ ભાગીદાર પ્રવેશની અસરો જણાવો.
  - ૩.૫ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન વચ્ચે તફાવત આપો.

**ENGLISH VERSION**

- Q.1 Answer each of the following in brief.** 08
- (1.1) What is partnership?
  - (1.2) Is balance sheet an account?
  - (1.3) What is Good will?
  - (1.4) State methods of resolution of a firm?
- Q.2 Give answer of any 4 from the following 5.** 12
- (2.1) Explain objectives for prepare final accounts of partnership.
  - (2.2) Explain characteristics of partnership.
  - (2.3) State necessity for goodwill valuation.
  - (2.4) Mention causes for change in partnership.
  - (2.5) State circumstances of retirement of a partner.
- Q.3 Answer any 3 from the following 5 in detail.** 15
- (3.1) Give differences between fixed capital account method and fluctuating capital account method.
  - (3.2) Explain trading account with specimen.
  - (3.3) What is revaluation account? Explain with specimen.
  - (3.4) Explain effect of admission of a new partner.
  - (3.5) Give differences between is solution of firm and partnership.